



JAZ-1601290202030900 Seat No. _____

M. A. (Sem. III) (CBCS) Examination

December - 2019

Home Science : CCT - 09

(Clothing & Textile-II)

(New Course)

Time : 2:30 Hours]

[Total Marks : 70

- ૧ વસ્ત્રોનાં મહત્ત્વ વિશે ટૂંકમાં સમજાવો. ૧૪
અથવા
- ૧ વસ્ત્રોપયોગી રેસાનાં ગુણો દર્શાવી, તેમાંથી કોઈ પણ દસ ગુણધર્મોની ચર્ચા કરો. ૧૪
- ૨ યાર્નનાં પ્રકારો દર્શાવી, તેમાંથી કોઈ પણ સાત પ્રકાર વિશે વિગતવાર સમજાવો. ૧૪
અથવા
- ૨ યાર્નનો અર્થ અને વ્યાખ્યા આપી, યાર્નનિર્માણની વિવિધ અવસ્થાઓ વિશે વિગતવાર સમજાવો. ૧૪
- ૩ વસ્ત્રનિર્માણ અંતર્ગત રેસાઓના ઉપયોગથી થતા વસ્ત્રનિર્માણ વિશે ટૂંકમાં સમજાવો. ૧૪
અથવા
- ૩ વસ્ત્ર-નિર્માણની પ્રક્રિયાનાં નામ લખી, રેસાઓનાં ઉપયોગ વગર થતાં વસ્ત્રનિર્માણ વિશે વિગતવાર સમજાવો. ૧૪
- ૪ ક્વિનિર્સીંગ એટલે શું ? યાંત્રિક ક્વિનિર્સીંગનાં કોઈ પણ દસ પ્રકારો વિશે સમજાવો. ૧૪
અથવા
- ૪ ક્વિનિર્સીંગનો અર્થ આપી, રાસાયણિક ક્વિનિર્સીંગનાં કોઈ પણ દસ પ્રકારો વિશે સમજાવો. ૧૪
- ૫ ટૂંક નોંધ લખો : (કોઈ પણ બે) ૧૪
(૧) તાંતણાની સંરચના
(૨) તારનાં ઉપયોગથી થતું વસ્ત્ર નિર્માણ
(૩) ટેક્સટાઈલ ટર્મિનોલોજી
(૪) ક્વિનિર્સીંગના હેતુઓ

ENGLISH VERSION

- 1 Explain about importance of clothes in short. 14
- OR**
- 1 Mention the properties of textile fibers. Discuss about any ten properties from them. 14
- 2 Mention the types of yarn. Explain in detail about any seven types from them. 14
- OR**
- 2 Give the meaning and definition of yarn. Explain in detail about the different stages of yarn construction. 14
- 3 Explain about the types of Fabric construction with the use of fibers. 14
- OR**
- 3 Write the names of process of fabric construction. Explain in detail about fabric construction without the use of fibers. 14
- 4 What is finishing ? Explain about any ten types of mechanical finishing. 14
- OR**
- 4 Give the meaning of finishing. Explain about any ten types of chemical finishing. 14
- 5 Write short notes : (any two) 14
- (1) Structure of fiber
 - (2) Fabric construction with the use of yarn
 - (3) Textile terminology
 - (4) Objectives of finishing.
-